

#### WEL/SEC/2024

February 02, 2024

To,

BSE Limited	National Stock Exchange of India Limited
1st Floor, Rotunda Bldg,	Exchange Plaza, C-1, Block-G,
Dalal Street, Fort,	Bandra Kurla Complex, Bandra (East),
Mumbai - 400 001.	Mumbai - 400 051.
Scrip Code: 532553	NSE Symbol: WELENT

Dear Madam / Sir,

#### **Subject: Newspaper Advertisement.**

In accordance with the Regulation 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find attached herewith a copy of the newspaper publications with respect to Un-Audited Financial Results for the quarter and nine months ended December 31, 2023 published on February 02, 2024 in Financial Express (English), Kutchmitra and Kutchuday (Gujarati).

Thanking you.

Yours faithfully,

#### For Welspun Enterprises Limited

Nidhi Manas Digitally signed by Nidhi Manas Tanna Date: 2024.02.02 19:48:09 +05'30'

Nidhi Tanna Company Secretary ACS-30465

Encl.: As above

	solution Process for Corporate Persons) R R THE ATTENTION OF THE CREDITORS	egulations, 2016) OF RITZY CHEMICALS PRIVATE LIMITED
		PARTICULARS
1.	Name of corporate debtor	RITZY CHEMICALS PRIVATE LIMITED
2.	Date of incorporation of corporate debtor	12/04/2007
3.	Authority under which corporate debtor is incorporated / registered	ROC Delhi
4.	Corporate Identity No. / Limited Liability Identification No. of corporate debtor	U74999DL2007PTC161977
5,	Address of the registered office and principal office (if any) of corporate debtor	DTJ 132, First Floor, DLF Tower-B, Jasola South Delhi, New Delhi, Delhi, India, 110025
6.	Insolvency commencement date in respect of corporate debtor	17.01.2024 (Order uploaded on NCLT website on 29.01.2024, Order Communicated to IRP on 01.02.2024)
7.	Estimated date of closure of insolvency resolution process	15.07.2024 (As per CIRP admission date i.e. 17.01.2024)
8,	Name and registration number of the insolvency professional acting as interim resolution professional	Parminder Singh Bhullar Reg. No. IBBIHPA-002/IP-N01127/2021-2022/13700
9.	Address and e-mail of the interim resolution professional, as registered with the Board	E-10/313, Mangal Puri Gali, Ghanupur Road, Khandwala, Near Water Tank, Amritsar- 143104, Punjab Email: advocate.psb@gmail.com
10.	Address and e-mail to be used for correspondence with the interim resolution professional	Unit No. 302, 3rd Floor, Plot No. D-190, Sector-74, Industrial Area, Phase-8B, SAS Nagar, Mohali-160071, Punjab Email: cirpritzy@gmail.com
11.	Last date for submission of claims	15.02.2024 (As per order communicated to IRP date i.e. 01.02.2024)
12.	Classes of creditors, if any, under clause (b) of sub-section (6A) of section 21, ascertained by the interim resolution professional	Not Applicable
13.	Names of Insolvency Professionals identified to act as Authorised Representative of creditors in a class (Three names for each class)	Not Applicable
14.	(a) Relevant Forms and (b) Details of authorized representatives are available at:	https://ibbi.gov.in/en/home/downloads Not Applicable

med against entry No. 10.

reditors shall submit their claims with proof by electronic means only may submit the claims with proof by post or by electronic means.

Sd.Parminder Singh Bhaltar
Reg. No. - IBBURPA-00/28F-N01127/2021-2022/137/06
Inlamir Rescludin Professional
For Ritzy Chemicals Private Limited
Ernal - circityt@gmail.com
Correspondence Address- Unit No. 302, 246 Floor,
Plot No. D-190, Sector-74, Industrial-74/ap. Plass-BP,
SAS Nagar, Mohall-160071, Punjab

#### NORTHERN RAILWAY CORRIGENDUM Ref: 1) Tender Notice No. 73/2023-2024 dated 96 ii) Tender No. 15235234 due on 13/02/2024. <u>.</u> 6/12/2023. ii) Tender No. 15235234 aue on Tarvezave». I. In reference to above tender specification has been revised. All other terms & conditions remain unchanged. The Corrigendum has been published on website www.ireps.gov.in. 342

SERVING CUSTOMERS WITH A SMILE

Welspun ENTERPRISES

#### **WELSPUN ENTERPRISES LIMITED**

CIN: L45201GJ1994PLC023920

Regd. Office: Welspun City, Village Versamedi, Taluka Anjar, District Kutch, Gujarat - 370110.

Corp. Office: Welspun House, Kamala Mills Compound, Senapari Bapat Marg, Lower Parel (West), Mumbai - 400013.

Website: www.welspunenterprises.com Email Id: companysecretary\_wel@welspun.com

Extract of Statement of Unaudited Consolidated Financial Results for the quarter / nine months ended 31 December 2023

П			Quarter ende	d	Period	l ended	Year ended	
Sr. Vo.	PARTICULARS	31 Dec 2023	30 Sept 2023	31 Dec 2022	31 Dec 2023	31 Dec 2022	31 Marc 2023	
- 1		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audite	
П	Total income	753,92	692.65	716,76	2,196,61	1,985.17	2,901.6	
2	Net Profit for the period from continuing operations							
	(before tax and exceptional items)	135.52	96.94	58.75	358.96	132.17	258.4	
	Exceptional items (net)	-	-	356.86	-	423.54	482.9	
.	Net Profit for the period from continuing operations							
- 1	before tax (after exceptional items)	135.52	96.94	415.61	358,96	555,71	741.4	
5	Net Profit for the period from continuing operations after tax	89.49	65,11	400.70	247.18	525,51	681.1	
	(after exceptional items and excluding non-controlling interests)							
:	Net Profit / (Loss) for the period from discontinuing							
- 1	operations after tax	(17,94)	(3,08)	-	(21,82)	55,75	41.	
-1	(after exceptional items and excluding non-controlling interests)		' '					
١.	Net Profit for the period from continuing and discontinuing							
í	operations after tax and after exceptional items and							
- 1	excluding non-controlling interests	71.55	62.03	400.70	225,36	581.26	722.	
	Total Comprehensive Income for the period from continuing							
	and discontinuing operations	71.28	65,22	400.72	228.03	580.37	719,	
	(Comprising profit for the period (after tax) and Other							
	Comprehensive Income (after tax) and excluding							
	non-controlling interests							
	Paid-up equity share capital (Face Value Rs. 10/- each)	136.41	136,41	149,98	136.41	149.98	149.	
	Reserves (excluding Revaluation Reserve)						2,206.	
	Earnings per share (EPS) for continuing operations *						-,	
	(a) Basic EPS (Rs)	6.55	4.78	26.75	17.98	35.04	45.	
	(b) Diluted EPS (Rs)	6.49	4,69	26,69	17.78	34.97	45.	
2	Earnings per share (EPS) for continuing and							
	discontinuing operations *							
	(a) Basic EPS	5.24	4.56	26,75	16.39	38.76	48.	
	(b) Diluted EPS	5.20	4.47	26.69	16.21	38.68	48.	

Notes:

The above is an extract of detailed format of quarterly and nine months ended financial results filled with the stock exchanges under Regulation 3 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation 2015. The full format of the quarterly and nine months ended financial results are available on the SIGO (Exchanges website www.neainda.com and aww.bseinda.com and also on company's website www.neainda.com and www.bseinda.com and also on company's website www.neainda.com and www.bseinda.com and also on company's website www.neainda.com and www.bseinda.com and www.bseinda.com and also on company's website www.neainda.com and www.bseinda.com and also on company's website www.neainda.

. /	Auditional information on standarding infancian results is as follows.										
- 11			Quarter ende	d	Period	Year ended					
Sr.		31 Dec 2023	30 Sept 2023	31 Dec 2022	31 Dec 2023	31 Dec 2022	31 March, 2023				
				(Unaudited)							
1	Total Income	606.83	571.05	680.16	1,887.33	1,891.36	2,775.01				
2	Net profit for the period (before tax and exceptional items)	111.94	76.86	55.08	308.84	124.51	250.16				
3	Net profit for the period before tax (after exceptional items)	111,94	76,86	522,88	308,84	597.57	760,06				
	Net profit for the period after tax	77.58	53.77	510.92	220.99	575.49	713.12				
5	Total Comprehensive Income for the period (after tax)	77.30	56.96	510.92	223.65	574.59	710.06				
					For Wel	spun Enterpr	ises Limited				

aging Director Place : Mumbai Date : 1 February 2024

ROHA HOUSING FINANCE PRIVATE LIMITED

MPDL LIMITED Regd. Office: 11/7, Mathura Road, Sector 37 Faridal ice: Unit No. 12, GF, Magnum Tower-1 Sector - 58, Golf Cou Phone: 0124-422434-35; Email: isc. mpdi@m

The members are hereby informed that pursuant to the provisions of Section 108, 110 are other applicable provisions of the Companies (Management and Administration) Rules, 2014 Rule 20 and Rule 22 of the Companies (Management and Administration) Rules, 2014 Secretarial Sharafuel Lesset by the testibute of Company Secretarial Sharafuel Agent 11, 110 April 11, POSTAL BALLOT NOTICE TO MEMBERS

Resolution:
Appointment of Mr. Sagar Tanwar (DIN: 10137884) as a Non-Executive Independ
Director of the Company for a term of 5 consecutive years.
The detailed instructions and information relating to e-voting are set out in the postal be
notice sent to the Members. The Company has completed dispatch of Notice of Posidulton Thursday Perkaruny 10; 2024.

the facility to exercise vote on postal ballot by remote e-voting shall be available dural slowing period:

The facility to exercise vote on postal saled by remote e-voling shall be available during the following period:

Commencement of e-voting: Saturday, February 03, 2024 (19.04 M. 187)

Commencement of e-voting: Monday, March 04, 2024 (5.09 P.M. 187)

Remote e-voting shall not be allowed after (50.07 P.M. on Microlay, March 04, 2023 and e-voting mode) and the disabled devocation. More of the control of the con

communicate their assent or dissent through the remote e-voting system only, person whose name is recorded on the Register of Members or in the Register senetical covers maintained by the depositories as on Thursday, January 25, 2024 bein the Louff Data shall be metited for avail the fields of enterior e-voting. The voting rights the members shall be recisioned in proportion to the paid-up value of shares in the to reciting capital of the Company of in the cost of disease.

prose only gift of the MCA Circulars shareholders who have not registered their email address; prosequence could not receive the Postal Ballot Notice may temporarily get their er sistered with the Company's Registrar and Share Transfer Agent, IMCS Share Trans-ent Limited, by following the registration procedure as guided in the Postal Ballot No det January 22, 2024.

eed January ZZ, 2024.

ry permanent registration/updation of the email addresses, members may send quest with the relevant Depository Participant in case of shares held in electronic for with the Company's Registers and Share Transfer Agent.—MCS Share Transfer Agent.—MCS Share Transfer Agent.—MCS Share Transfer Agent.—MCS Share Transfer Agent.—

cose shareholders who have already registered the remail address are requested to kee eir email addresses validated with their Depository Participants / the Company's RTA able servicing of notices / documents/Annual Reports electronically to their email address The second of th For MPDL LIMITED

DECOROUSINVESTMENT a
TRACING CO. LTD.
CIN: LE7/2001-1982PLC28990
Regd. Office: R-1989, G-FG, New Rajin
Nagar, New Delhi - 110000
Tra No.: 9910003838,
"maillid: decorous 1982@gmmi.Lo
"alte: www.dtco.in

Toll No. - Sealed decrease of Reag-Website, www.disco.in No. 1026.
Pursuant to Listiny Agreement(s) with BSE LT (ACSE) About to Directly gave that Meetings Advant Committee & Board of Directly scheduled to be held on MORIANY - 71.07.2 or 10.00 at 11.00 At 11.00 At NeapostIvely at 18 or 10.00 at 11.00 At NeapostIvely at 18 or 10.00 At 11.00 At NeapostIvely at 18 or 10.00 At 11.00 At 11.0 Un-Audited Financial Results or Querry in NINE-MONTHS ended 31.12.2023 along Limited Review Report from Statutory Audit Tradian Window in equity shares will ren mited Review Repros.
rading Window in equity shares will relosed from 01.01.2024 to 15.02.2024 fonsiders, and Any other matter with
nermission of Chair.

Raj Kumar G

New Delhi 01.02.2024 IN THE COURT OF THE DISTRICT MUNSIF, OTTAPIDARAM I. N. N. 12023 IN OS No. 2/2023 1. M. Pandi 2. Subbulakshmi 3. Ramalakshmi Petitoners / Plaintiffs

DELITE TECHNOBUILD PVT, LTD., Office at No. 15028, 15th Floor, Statesman House, Barakhamba Road, New Delhi - 110001

Statement Focus, Samatherman Rous, Samatherman R

Form No. INC-26 suant to Rule 30 of the Companie Form No. INC-26
(Pursuant to Rule 30 of the Companies (Incorporation) Rules. 2014)
Before the Central Government, segional Director, Northern Region, New better matter of sub-section (14) of Section 15
Companies Act, 2013 and clause (a) of sub-cule (15) of Rule 30 of the Companies (Incorporation) Rules, 2014

Incorporation) Fules, 2014
AND
In the matter of
RUPS LIFESCIENCES PRIVATE LIMITED
(CIN: U29220DL2007PTC161311)

Cité L'02/2012/2017/01/11311
Ibening in Segolated Citico et au
Maper, New Deph-110599
Maper, 2024 to enable the Company of
January, 2024 to enable the Company of
Ja

mentioned below:-A-4, Gali No. 1, Yadav Enclave, Vikas Nagar, New Delhi-110059 For & on behalf or RUPS LIFESCIENCES PRIVATE LIMITER

(DIRECTOR) DIN: 02835163 financi<mark>alem.ep.</mark>.in

Before the Central Government Registrar of Companies, Dalle 1, 1985. The Section 1 of Decimal 1 of Decimal 1 of Decimal 1 of Lineau 1 of L

For on behalf of TaxEdge Boutique LLP Sdi-Sdi Name: Abhishek Kumar Chhapolik Designated partne DPIN: 0859445' Rio: Ground Floor, Office No 2, D 248 Gal No 10, Laxmi Nagar, New Delhi-11099; Data 081022024 Date: 01/02/2024 Place: New Delhi

ROHA HOUSING

POSSESSION NOTICE (Under Rule 8 (1) of the Security Interest (Enforcement) Rules, 2002) Whereas the undersigned being the authorized officer of Roha Housing Finance Private Limited (hereinafter referred to RHFPL\*), Having its registered office at JJT House, A 4445, Road No.2, MIDC, Andheri East, Mumbai - 400 993 under foreurististion and Reconstruction of Financial Assets and Enforcement of Security Housest Act 2002, 564 (2002), and in even norrus, I harmy as regisered office at Jul House, A 4445, Road No.2, MIDC, Andheir East, Mumba - 400 DSI under Scortification and Reconstruction of Financia Assessa and Informed of Scoruty/Interest, (2002 (54 c000)), and in sensities of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Scoruty Interest (Enforcement) Rules, 2002 sessed Demand Notice datal metaloon below under Social (30) (20) the said A calling upon you being the browners (amenia and addresses mentioned below) to repsy the annount mentiones in me said notice and immest record within 0.00 system of the data of section of the said notice. The browners and addresses mentioned below) to repsy the annount mentiones in me said notice and immester record within 0.00 system the data of record in the said notice. The browners mentioned the said notice. The browners mentioned herein blow having that the said notice. The browners were also seen to the property described mention below the said notice. The browners mentioned has based symbolic Possession of the property described therein blow in measured of provers conferred on me under size section (4) of section 13 of the Act read with the Rule 3 of the Scoruty interest (Enforcement) Rules, 2002. The browners mentioned have in above in particular and the public in general that the entirely action of the old with this said property in and profities with the property will be aboyled to the Charge of Rolling provisions of allow bedieved to 3 of the Act, in respect of their available, to redeem the secure describe.

St. No.	Name of the Borrower(s)/Co-Borrower (s)/ Lean A/c No./ Branch	Schedule of The Properties	Demand Notice Date & Amount	Date of Possession
03	LAN: LANODCLPRS000005002945/ Branch: Noida 1. Devender Singh 3. Intu W/o Devender Singh 8. Both Add 1: H. No. 285, Gali No. 09, Sourabh Vihar, Delht, New Delhi: 110044 8. Both Add 2: H. No. 282, Saurabh Vihar Jaitpur, Delhi, New Delhi: 110044	All that Part and Parcel of Complete Property bearing- House No. 8-P. Surya Nagar Phase II FF. Residential Scheme Sector 91, Tehsil & District Faridabad, Haryana, Faridabad- 121003 Haryanan	12.09.2023 & ₹ 15,21,148/-	27-01-2024
	ice : Noida te : 02.02.2024		- Authorised Offi ng Finance Priv	

GOVERNMENT OF TAMILNADU / WATER RESOURCES DEPARTMENT PALAR BASIN CIRCLE, CHEPAUK, CHENNAL-600005.
Form of BALAR BASIN CIRCLE, CHEPAUK, CHENNAL-600005.
e-Index Short Term Notice No. 18 PBC / (2023-24) C13.101.202 death of the Modern of Tamil Nadu, e-Index are invivade by the Special Chelf Engineer. WICO.
acc Circle, Chernal Grant of Two Cover Sprint\* "through ceils for the below mentioned with from the Approximate Value | Loca data am

No.	Name of Work	put to Tender (including GST ⊚ 18%) Rs. in Lakh	Last date and time of submission of Tender (as per Server Clock)	Tender opening (as per Server Clock
1	Providing Retaining wall for Existing Channel and Formation of Cut & Cover micro drain under the Existing Board from Sembaskam Tank surplus course to Nammangalam Tank in Tambaram Taluk of Chengalpatta Ustrick.	2427.00	08.02.2024 upto 12.00 Hrs.	08.02.2024 at 15.15 Hrs.
2	Construction of cut & cover from Moovarasampet tank to Keelkatalai channel of Tambaram Tatuk of Chengalpattu District.	3065.00	08.02.2024 upto 12.00 Hrs.	08.02.2024 at 15.30 Hrs.
3	Construction of additional double vant cut and cover macro drain from Narayanapuram tank to Pallikaranai awamp in Solinganaitur Tatuk of chennai Distroit.	3983.00	08.02.2024 upto 12.00 Hrs.	08.02.2024 at 15.45 Hrs.
4	Strengthening and formation of flood bank with River Training Works damaged due to Cyclone Michaung in Araniyar River from LS.60.135 Km to 103.600 Km in Throvallur District.	2247.00	08.02.2024 upto 12.00 Hrs.	08.02.2024 at 16.00 Hrs.
5	Rehabilitation of Nemam Tank Surplus regulator shutters and strengthening of Tank Bund damaged due to Cyclone Michaung in Nemam Tank in Poonamaties Taluk of Thiruvalfur District	1220.00	08.02.2024 upto 12.00 Hrs.	08.02.2024 at 16.15 Hrs.
6	Rehabilitation of North Ann of Coovum River from LS 0 m to LS 2040 m in Purasaiwakkam Taluk of Chennai District	1731.00	08.02.2024 upto 12.00 Hrs.	08.02.2024 at 16.30 Hrs.
7	Strengthening and formation of Left flood bank with River Training Works damaged due to Cyclone Michaung in Araniyar River from LS. 119.700 Km to 123.800 Km in Thruvallur District.	1835.00	08.02.2024 upto 12.00 Hrs.	08.02.2024 at 16.45 Hrs.
8	Strengthening and formation of flood bank with River Training Works damaged due to Cyclone Michaung in Araniyar River from LS 124, 150 Km to 126, 100 Km in Thirpysillur District.	1600.00	08.02.2024 upto 12.00 Hrs.	08.02.2024 at 17.00 Hrs.

## MINDA CORPORATION LIMITED

REGD. OFFICE: A-15, Ashok Vihar, Phase-I, Delhi- 110052 CIN: L74899DL1985PLC020401 Tel.: +91 120-4442500, Fax.: +91 120-4787201 E-mail: investor@mindacorporation.com, Website: www.sparkminda.com

EXTRACTS OF THE CONSOLIDATED AND STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31 DECEMBER 2023

Rs. (in lakhs)

SPARK MINDA

			Consc	lidated					Stand	lalone		
Particulars	Quarter Ended			Nine Months Ended Year Ended			Quarter Ended			Nine Months Ended		Year Ended
ratticulars	31 Dec 2023	30 Sep 2023	31 Dec 2022	31 Dec 2023	31 Dec 2022	31 Mar 2023	31 Dec 2023	30 Sep 2023	31 Dec 2022	31 Dec 2023	31 Dec 2022	31 Mar 2023
	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
Total income from operations	1,16,779	1,19,787	1,07,299	3,44,210	3,23,898	4,31,592	97,091	99,228	87,261	2,84,547	2,62,040	3,53,436
Net Profit for the period (before tax and exceptional items)	7,580	7,700	7,388	21,623	22,958	29,847	6,670	6,422	5,580	17,770	17,435	25,002
Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary items)	7,580	7,700	7,388	21,623	22,958	29,847	6,670	6,422	5,580	17,770	17,435	22,502
<ol> <li>Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items)</li> </ol>	5,249	5,877	5,226	15,647	16,256	28,450	4,432	4,777	4,078	12,693	12,983	24,061
<ol> <li>Total comprehensive income for the period {comprising Profit for the period (after tax) and other comprehensive income (after tax)}</li> </ol>	12,115	22,741	5,277	42,770	16,539	28,320	11,249	21,848	4,062	40,005	12,930	23,457
Equity Share Capital	4,782	4,782	4,782	4,782	4,782	4,782	4,782	4,782	4,782	4,782	4,782	4,782
Other Equity (excluding Revaluation Reserves as per the Audited Balance Sheet)						1,54,292						1,33,637
8. Earnings Per Share (of ₹2/- each) not annualized a) Basic (in ₹) b) Diluted (in ₹)	2.23 2.19	2.50 2.46	2.22 2.19	6.65 6.54	6.91 6.79	12.09 11.89	1.85 1.85	2.00 2.00	1.71 1.71	5.31 5.31	5.43 5.43	10.06 10.06

1. The above financial results were reviewed by the Audit committee on 01 February 2024 and approved by the Board of Directors at their meeting held on the same date.

2. The above results have been prepared in accordance with the Indian Accounting Standards (Ind-AS) as prescribed under Section 133 of the Companies Act, 2013 read with the relevant Rules issued thereunder at other accounting principles generally accepted in India.

3. The Board of Directors of the Company has proposed interim dividend of Rs. 0.50 per equity share (25%) (face value of Rs. 2 per share) aggregating to Rs. 1,195.40 lakhs for the year 2023-2024 in its meeting held of 1 February 2024.

UT Feorinary 2024.

A. The above is an extract of the detailed format of the Financial Results for the quarter and nine months ended on 31 December 2023 filed with the Stock Exchanges pursuant to Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, The full format of the standatione and consolidated results are available on the stock exchanges website(s)\_www.knseindia.com\_aww.bseindia.com\_aww.bseindia.com\_aww.bseindia.com\_aww.bseindia.com\_aww.bseindia.com\_aww.bseindia.com\_aww.bseindia.com\_aww.bseindia.com\_aww.bseindia.com\_aww.bseindia.com\_aws.bseindia.com\_aww.bseindia.c

For and on behalf of the Board of Director

Date: 01 February 2024







Ashok Minda Chairman & Group CEO Minda Corporation is a flagship company of Spark Minda, one of the leading automotive component manufacturer in India with a pan-India presence and significant international footprint.

કરછ

## અંજાર-મુંદ્રા નેશનલ હાઈવે પરનો આ ખાડો ગમે ત્યારે અકસ્માત સર્જશે

વોવાર (તા. મુંદરા), ૧ : અંજાર-મુંદરા નેશનલ હાઈવે પર અંજાર તરફ જતો સર્વિસ રોડ પરનો ખાડો છેલ્લા કેટલાય સમયથી યથાવત પડ્યો છે, છતાં ઓથોરિટીના આંખે આડા પાટા છે. જે કોઈ નિર્દોષનો ભોગ લે

લવાભવશ. જાગૃત નાગરિકોએ રાવ ઉઠાવી કે, આ સેડ સીધો અંજાર શહેરને જોડે છે. અહીં નાના મોટા



વાહનોની ભારે અવરજવર સતત ગાલુ હોય છે, પણ રોડ એજન્લીઓ વાહનાયાહકોની સમસ્યાઓમાં સત્ર હતી નથી. યુક્યાય તો ખાત્રમાં પડી શકે છે. તમાં સર્વિસ ટોડની વચ્ચે સિમેન્ટની તૈયાર વોલ ઉબેલી છે જેમાં પણ વાહન અથડાઈ શકે છે અને અકસ્માત થઈ શકે છે.

આસપાસ પ્લાસ્ટિકની રેલીંગ લગાવી દેવામાં આવેલ છે, જેમાં રેડિંયમ નથી. રાત્રે તાહન યાલકોને ખારા કેવી રીતે પડે કે આ રસ્તો અલ્ધો જ ખુલ્લો છે ? આ ધ્યામાળા રસ્તા પરથી, ભયજન્ય કરીંતે દૂર કરવામાં આવે એવી માંગણી છે.

કોટડા (ચકાર)ની ડી.ડી. ધોળુ સરસ્વતી શિશુ મેં દેર, પ્રા. શાળા, હાઇસ્કૂલનાં બાળકો માટે આયોજન કરાયું

નારશુભાઇ ગઢવીએ હતાવ આપ્યું હતું, મુખ્ય વક્તા અભિદ ભારતીય રાષ્ટ્રીય શૈકિક મહાસંય સરકારી મામભિક વિભાગના અમલા મુજબાઈ ગઢવીએ સ્વામી વિવેકાનંદ અને સુભાયગંઢ બોઝના જીવન-કવનની ઝોખી રજૂ કરી શિકાનો શ્રેષ્ઠ કર્તન ભિવાવવા આદ્ધવાન કર્યું હતું તથા માત્ર હક નહીં પણ કરજન્ પ્રધાનન આપી રચનાત્મક ક્રયાં કરતા શિક્ષક સંગઠનની તો ટ્રસ્ટના અગ્રણી અશ્વિનભાઇ ધોળુએ શ્રી માકાણીની આવી કામગીરીને બિસ્દાવી હતી. અમુક વ્યવસાયકારો બાળકોના સવાલ-જવાળથી ખુશ થઇ ગયા હતા.

જાહેર નિવિદા

💬 કામનું નામ : બોલેરો જીપ રિપેર કરવાનું કામ

(બામાબિ-ઉચ્છ-૧૦૧૮-૨૦૨૩/૨૪)

સવારે ૮.૦૦ શીડાવોરે રૂ ત્યા. ૦૩-૦૨-૨૦૨૪ લામાં આપવા તેમાં વસ્તાર આવતો તમામ વિસ્તાર

આવતાં લામાં મારણાટ સ્વારે c.oodl જાોદે જ તા. લ3-0૨-૨૦૨૪ સ્વારે c. oodl જાોદે જ સ્વારે c. oodl જાોદે જ તા. લ3-0૨-૨૦૨૪ તા. લ3-0૨-૨૦૨૪ સ્વારે c. oodl જાોદે જ ત્યાર જેવા સ્વાર અને લાકર્સિયા (એજી કીક્સમાં આવતો લ્યામ વિસ્તાર)

તાવતા તામામાં ાવસ્તાર) સવારે ૮.૦૦થી બપોરે ૪ જુ ના કરારિયા, શિકારપુર, સુરજબારી, નારણસરી તેમજ તા. ૦૩-૦૨-૨૦૨૪ સુરજબારી(જેજીવાચ) ફીડ્સમાં આવલો તમામ વિસ્તાર

સવારે ૮.૦૦**ટી બ્યોરે ૧૧**ામસાઉ સીટી (અર્બન) ફ્રીક્ટમાં આવતો તમામ વિસ્તાર

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વિભાગીય કચેરી, ભચાઉ-કચ્છ

જાહેર વિજ્ઞપ્તિ રાશી અમારા માનવંતા વીજરાહકોને જણાવવાનું હે, અત્રેની પેટા વિભાગીય કહેરીમાં નીચે જણાવેલ ફીડરો જરૂરી સમારભાગમાટે નીચે જણાવ્યા પ્રમાણે તારીખના રોજ બંધ રહેશે. ભગ પૂર્ણ ચર્ચે અન્ય કોઇ પણ જાતની સૂચના આપ્યા વગર વીજપુરન્હો પુનઃ રાશુ કરી રેવામાં આવશે. જેની નોંધ લેવા વિનંતી.

મુંદરા, તા. ૧ : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહારાંઘ દ્વારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મુંદરા તાલુકા દ્વારા ઝરપાય હાઇસ્કૂલ ખાતે કર્તવ્યબોધ દિવસની (જ્લ્લા) દ્વારા પાન ગતિવિધિની માહિતી આપી હતાી. ઉચ્ચતર માધ્યમિક સંવર્ગના શિક્ષકો જોડાયા હતા. સંચાલન્ ગાતાવાધના માહલા આપા હતા. ઉચ્ચતર માધ્યમક આ તકે રાષ્ટ્રીય શૈક્ષિક શિક્ષકો જોડાયા હતા. મહાસંઘ કચ્છ જિલ્લા ક્રોથાધ્ય પુનશીભાઈ ઝઠવાં વાલજીભાઇ મહેત્વરી, જિલ્લા આભારવિયિ હૈં મહિલા સહમંત્રી નિયિબેન ભરાડિયાએ કરી હતી. પુનશીભાઈ ગઢવી આભારવિધિ હી હીરજીભાઇ



હોઇસ્કૂલ ખાત કતવ્યબાય દિવસનીઉજવણી કરવામાં આવી

હતી.


હતી.
મહાનુભાવો દ્વારા દીષ્ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું, ત્યારબાદ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, કાર્યક્રમનું પ્રાસંગિક આશાનદ ગઢવીએ આપ્યું હતું, અંધેકાના મૃપ્યકાતીયિ – મુખ્ય શિસક સવર્ગ જિલ્લા સંગઠન મંત્રી નારણભાઇ ગઢવીએ વક્તળ આપ્યું હતું, મળ વસ્તા અભિવ

ઝરપરા ખાતે કર્તવ્થબોધ દિવસ ઊજવાયો

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ

ભાગીય કરોરી, ભુજ-કચ્છ. ફોલ્ટ રોન્ટર નંગર-લ્દર હદ્દ 33દ્દ લ્ અત્રેની ભ્યેરી હેઠળ નીચે દર્શાવેલ તારીજે ફીડરોનું જરૂરી સમારઠામ હોવાથી વી કુરવડો ભંધ રહેશે. હામ પૂર્ણ રહ્યે અન્ય સૂચના વગર વીજ પુરવઠો પુન: હાર્યસ્ત થશે.

સંદા રહેવાન તારીખ અને સમય ૧૧ કે.વી. ફીડર તથા લંધ રહેનાર વિસ્તાર 03/07/२०२४ ૮.૦૦થી ૧૮.૦૦ તેમજ હરિપર એજી ફીડરોના હેલ્લાનો તમામ વિસ્તાર



વીજળી પુરવઠો બંધ રહેવા બાબતની જા<u>હેરાત</u> આર્સી અમારા માનવંતા ગ્રાહકોને જણ કરવાની કે, તારીખ ૦૩-૦૨-

૨૦૨૪, શનિવારના ૨ રોજાગત્થનું સમારકા મ્લોવાથી નીચે દર્શાવેલ સામ્ય ાહેરીઅને ઔદ્યોગિક વિસ્તારોને સવારના ૦૮:૦૦ વાગ્યાથી સાંજના ૦૫:૦૦

તારા રાજા જાતાના ગુલ હતારા જ તાપણ છે કે છે. વાચ્યાના તાપણ ઇંકાઇ વાચ્યા સુધી વીચ્યુ પ્રચાડ માત્રા અર્હી વિસ્તાર : (૧) દ્દ હે.વી. પત્રી જબ સ્ટેશનમાંથી નીકળતા તમામ ૧૧ હે.વી. ફ્રીક્સે તાર્રીખ ૦૩.૦૨.૨૦૨૪, શનિવારના સવારના ૦૮.૦૦ વાચ્સાથી જના ૦૫.૦૦ વાગ્યા સધી ભંધ રહેશે.

?) દૂદ કે.વી. બંધરા સબ સ્ટેસનમાંથી નીક્ળતા તમામ ૧૧ કે.વી. ફીકરે ારીખ ૦૩.૦૨.૨૦૨૪, શનિલારના સવારના ૦૮.૦૦ વાગ્યાર્થ

ારાંખ ૦૩,૦૨,૨૦૨૪, શાબલારના સવારના ૦૮.૦૦ વાગ્યાંચા પાંજના ૦૫.૦૦ હામાં યુપિકાયર્સને નિર્ધારીત 6મા પહેલું પૂર્વે થઈ જતાં હોજી કોઈ પણ જાતની જાહેરાત આપ્યા સ્થાયયુનઃ વીજપુરવાઠે સ્થાપિત કરવામાં આવશે, તેની નોંધ હેવા બિતારી છે. કાર્યાયાલ ઈંજનેર (પ્રવાદન), કાંજર બિલ્મગીય કરી રી, ગેટકો, કાંજર (કથક)

## નખત્રાણા નગરપાલિકા 'ઈ-ટેન્કરિંગ નિવિદા' (બીજો પ્રયત્ન)

34	કામની વિગત	અંદાજિત ૨૯મરૂદ	ઇ.એમ.ડી.ની ૨૯મ રૂા.	ટે <i>ન્ડરફી</i> રૂા.
٩	નખત્રાણા નગરપાલિકાના વિસ્તારમાં MP, MLA તેમજ રાષ્ટ્રીય તહેવારોની ગ્રાન્ટમાંથી જુદા જુદા કરવાના કામો	6,90,000]-	90,000/-	600J-

166 નખત્રાણા નગરપાસિકાન 1/MP, MLA/ /२०२४ રીફ ઓફિસર ાા. ૧/૨/૨૦૨૪ નખગાણા નગરપાલિકા (નામાનિ-કસ્થ-૧૦૨૬-૨૦૨૩/૨૪)

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ.

એરા.ટી. બસ ડેપોની ભાજુમાં રોટરી હોલની સામે, વર્તુળ કચેરી, અંજાર

http://gui-epd.gov.in www.pgvcl.com

ટેન્ડર / ઇ-ટેન્ડર નોટિસ નં. ANJ ૧૫૪ હેન્દ્રસ્તૃ (ઇ-હેન્દ્રસ્તુ નારિક્ષ ના. ANJ પપ્ત એકની. એકારીમાં, એક્સ્ટનાઈ, એક્સ્ટેન્સ અને એન્સ્સ માનાઓ હેતા એકારી[ઓહરી] કિસી પહેલાના. મેન્ટ્રેન્સના અને મહિલું કામ અંભર શહે-તા)-મને બી કોમ્પર (બી.). (બાગ-પ્સે બી.). પે. હિ. અંભર દિ. (બાગ-પ્સે બી.). કેમ્પર (બી.). (બાગ-પ્સે બી.). પે. હિ. અંભર દિ. હેતા કેમેલા કોમ્પર (અને અંભર અને પ્રાથમ પ્રાથમ રિ. હેલા તાર હેમા, 3 ફેઝ મીટર નવા હત્મેલામાં અને પ્રાથમ રિ. હેલા પોત્ર બાર હેમાં, 3 ફેઝ મીટર નવા હત્મેલામાં અને પ્રાથમ રિ. હેલા પોત્ર બાર અને કીમી એન્સનનનું લાખ સ્થામ સામ કામ રા, ૧, અંભર વિદે હેલા પોત્ર બાર અને કીમી એન્સનનનું લાખ સ્થામ સામ કામ રા, ૧, અંભર વર્ષેટ અને મેશાય (બી.) પે. હિ. અંભર હિ. હેલા (માર્સ્સ) ચાલમાં એક્સનનું લીધોની! કામ્યત્ર કર્ફ / સેમો તારે સમાનાનું કામ મામાં હિ. હેલા (મારમ) ચાલમ) અંભર વિભાગીય ઓફિલ બિલિંગનો રીનોએલાનનું લાખ અંભર વર્ષેણ લીધીની કેસ્ત હેલા. તે હેલા હોલા દેવામાં કામ કામ્યું કામ અંભર વર્ષાણ લીધીની કહિન્તા? એ હેલા હોલા દેવામાં કામ્યું કામ પ્રામ્ય પાત્ર (બેલા, ૧) કહિન્તા? એ હેલા હોલા દેવામાં કામ્યું કામ પ્રામ્ય પાત્ર (પેલા, ૧) ખમારી વેબસાઇટ www.pgvcl.comપર અધિકાક ઇજનેર, અંજાર ગાહક સુવિધા કેન્દ્ર ઢોલ ફ્રી નં. ૧૮૦૦૨૩૩૧૫૫૩૩૩/૧૯૧૨૨

#### ગુજરાત સરકાર

ગુપ્ટલા સરકાર નર્મદા, જળસંપતિ, પાણી પુરલા અને હવાસર વિભાગ, સચિવાલય, ગાંદીનગર જાતેરનામું જમીન સંપાદન, પુનસ્થાન અને પુનર્યસવારમાં વાજળી વળતર અને પારાર્થિતાનો અધિકાર અધિનશમ-૨૦૧૩ (૨૦૧૩નો ૩૦મો)

irca) : કરાય માંક : અમીબજા ૨૦૨૪ -૨૨(જ.સં, ૨૦૨૨)કરાયા (તારીખ :૧૫/૦૧/૨૦૨

ા કાશેની અનુસૂચિમાં દશીવવામાં આવેલ જમીઓની જવેર હેતુ માટે એટલે માંદા ચોખનાની ક્લાઇ લાગ્ય હેનાલાના એપ્રોરેસ રોડના બાંધાભાગાની હજા દ્યાનો સંભવાડેએ તું ગુજરાતસરહારનેજણાચાડે.

કલોક નંબર/ સાર્વે નંબર	જરૂરી જમી-લોનું કોઝફળ (તે.આરે.સો.મી.)	જે જાહેર હેતુ માઢે જમીનની જરૂર છે તે જાહેર હેતુ
464/461 2	00-29-84	सरहार सरोधर बर्भहा निगम सि.
466/8	00-03-33	तस्तवजी नगंदा योग्रजानी करा
પલ 3/પેલી ૧	00-04-00	
પલ્સ/વૈકી ર		ભાન્ય કેનાલના એપ્રોય રોડના
Gct-on	00-34-38	બાંધશમ માટે

ાર્ગદા જળસંપત્તિ અને પાણી પુ અને કલ્પસર વિભાગ, ગાંધીન

# વિદ્યાર્થીઓએ વિવિધ વ્યવસાયકારોની પ્રત્યક્ષ મુલાકાત લઇ કામગીરી જાણી



કોટડા (ચકાર)ની શાળાના વિદ્યાર્થીઓએ વ્યવસાયકારની મુલાકાત લઇ કામગીરી જાણી ત્યારની તસવીર. (તસવીર : **ફકીરમામદ ચાકી**) લઇ કામગીરી જાણી ત્યારની તસવીર. (ત**સવીર** : **ફકીરમા** 

> થયાં હતાં. આચાર્યા ચેતનાબેન માકાણીએ બાળકોને આ માહિતી ઉપયોગી થશે તેમ જણાવ્યું હતું.

૧૧ **હે**.વી. ફીડરનું નામ/ (પેટા વિભાગીસ કરોરીનું નામ)

૧૧ કેવી જંગી (જેજીવાય/સામખિયાળી)

૧૧ ઠેવી સાગબિચાળી (જેજીવાચ/સામબિચાળી)

૧૧ કેવી ભારત (જેજીવાથ) લાકડીયા એજી)/સામખીયાળી

૧૧ ફેવી સે ક્ય**ા**લી (ઝે.મેવાડા)

૧૧ કેવી સુદાશા (જેજીવાચ)

૧૧ કેવી આદર્શ (જેજીવા 🕸

૧૧ કેવી જેસકા (એજી), સાત્રક્ષી (એજી), વણોઇ (એજી)/

૧૧ હેવી ભયાઉ સીટી

(શાડાન)/ભરાઉ)

કોટડા (ચકાર), તા. ૧: વિદાર્યીઓએ શિલણ મેળવવા નવતર અભિગમ અપનાવી મોચી, વાળંદ, દરજી સહિતના વ્યવસાયકારોની પ્રત્યક્ષ મુલાકાત

લીધી હતી.
અહીંની વિદ્યાભારતી
સલગ શ્રીરામ કુષ્ણ શિક્ષા સાધના ટ્રસ્ટ સંચાલિત ક્ષી. ક્ષી. ધોણ સરસ્વતી શિફ્ષાનંદિર, પ્રાપમિક શાળા, હાઇસ્ક્ર્લના વિદ્યાધીઓએ પ્રધાનાચાર્યના પ્રગાદકોન હેઠળ આચાર્ય સત્તાલેન પાકણીની આગેવાની હેઠળ ભાળકોને મોચી, વાર્ળદ, દરક્ષ્ય હતાર શાદભાજ સ્વા કરળ બાળકામ નાયા, યાળક - વસ્ત્રો, ખેત ઓજારો, હેક્ટર, ગ્રામ પંચાયત, રાશન શોપ -દીનદપાલ સ્ટોર, ખેતપેદાશો, ખેતીની દવા - ખાતર સહિતના તપાપ ધંધાર્થીઓ સમક્ષ જઇ તેમનું કામકાજ કેવી રીતે કરે છે તેમજ તેમને આ કામગીરીમાંથી કેટલું વળતર મળે છે, તેની અનુભવજન્ય માહિતી મેળવી હતી. આ નવતર ગ્રામ્ય પ્રવાસ અને વિવિધ ધંધાર્થીઓની જાત માહિતી નાની ઊં મરે પ્રાથમિક કક્ષાએ મેળવી બાળકો આનંદિ.ત

## મુસ્લિમ એજ્યુ કેશન શાળાનું ગોરવ



ગમ અના અસસાર વાડ્યાડા કા લાયકાત ધરાવે છે. છેલ્લા પાંચ વર્ષથી શાળામાં ધો. ૧૧-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાન ભણાવે છે.

ભુજમાં પરીક્ષાલક્ષી ચિંતા સંદર્ભે યોજાયો સેમિનાર ભુજ, તા. ૧ : અહીંની ધો. ૧૦ અને ૧૨ની વિદ્યાર્થિનીઓ ૧૦ અને ૧૨ના વચાવતાના માટે પરીક્ષાલક્ષી ચિંતામુક્ત કરવાના હેતુસર ઈંત્રરવ્હીલ ક્લળ દ્વારા એક સેમિનારનું

ક્લળ દ્વારા એક સામનારનું આપોજન કરાયું હતું. માતૃછાયા કન્યા વિદ્યાલય તથા ઇન્દીરાભાઈ ગર્સ્સ હાઈસ્કૂલની છાત્રાઓને ગેમ્સના મનોચિકિત્સક હો. મહેશ દીલવાણીએ માર્ગદર્શન આપતા

ટેલિવાણાંએ માગદરાન આપતા કહ્યું હતું કે, જીવનમાં પરીક્ષાઓ તો આવતી જ રહેશો. તેનાથી બભરાવવાની જરૂર નથી. આત્મિલિયાસ કેળવીને તેનો સામનો કરતાં શીખવું પડે. આ પ્રસંગે ક્લબના પ્રમુખ ગોપીબન રાહોડ, મંત્રી શીલા ભદ, પ્રો. ચેરમેન પ્રેમલાના નિહાલણીએ વતનાનો આભાગમાંનો હતો

વક્તાનો આભાર માન્યો હતો.

પશ્ચિમ ગુજરાત વીજકંપની લિમિટેડ <sup>વિભાગીય કરોરી, અંજર-કચ્છ.</sup> વીજપુરવઠો બંધ રહેવા અંગેની જાહેર નોટિસ

અરજદાર પોતાની ફરિયાદ અનારી હંબનીના ટોલ ફી નંકાર - ૧૮૦૦૨૩૩૧૫૫૩૩૩ તથા સામભિયાળી, ભયાઉ અને ભારતસ્ત્ર પેટા વિભાગીય ક્યોરીના કમ્યેલેન્ટ હોલ સેન્ટર નંબર - ૯૬૦૧ ૩૩૬,૪૪, ૯૬૦૧૬ ૩૩૬,૪૦, ૯૬૦૬ ૩૩૬૭૨ પરદર્જ ક્યાંલી (જણાવી) શહેઇ. ક્યાંગલક ઈજનેર, વિભાગીયા ક્યેરી, પી.જી.લી.સી. એલ., ભયાઉ

di. 08-02-2028

ાથી અમારા માનવંતા વીજગાહકોને જણાવવાનું હેની શે મુજબના વીજફી ડ્ટોનું સમાસ્ટ ફીડરો નીચે જણાવ્યા મુજબની તારીખ અને સમય પ્રમાણે બંધ રહેશે. કામ પૂર્ણ થયે અન્ય કોઇ પણ જતની સૂચના આપ્યા વગર વીજપુરવઢો પુન ત્યાલુ કરી દેવામાં આવશે. જેની નોંધ લેવા વિનંતી.

કમ	ફીકરનું નામ	તારીખ	સમય	બંધ રહેનાર વિસ્તાર
	૧૧ કેવી વિવેશ પંજાવતા			નીલ કંઠ, રિવેશ, એરપોર્ટ, રાજવી, ઓપલ પા કંલેન્ડ, શાંતિપાલ-
	-		સવારે	૧,૨,૩,૪,૫ સોસાયટી તેમજ આજુદરાજુમાં આવેલ સોસાયટી વિસ્તાર
٩	१९ हेवी कांग्र होता.ही. होत्रकोश (क्लार सम्बन्द वेट (हिन्दान)	03-05-58		નર્મદાએય.ટી. કનેક્લન.
	૧૧ કેવી વર્ષભેડી એટા (મેદાવર (લી!) પેટાવિલ અ	(शनिवार)	₹.00	ગમપાંદર ગામ તથા વર્ષામેડીની માજુ-બાજુનો વાડી વિસ્તાર.
	११ हेवी अधिकाना चेत्रावा		सवारे ए.००थी	સ્તનલ, કંઢેશથે ગામના અમુજાતુનો સ્ટેશાંક વિસ્તાર
5	१ १ हेवी मुझूबा स्टेस			રતનારા, કહેરાઇ ગામની ચામુખાયુંનો સીંગ વાડી વિસ્તાર
	१९ हेर्ज करेश क्षेत्र (क्षान्त्र अन्य-१ चेटा क्षित्र १		બપોરે ૨.૦૦	સ્તનાલ, ઇંઢેરાર્થ ગામની આયુપ્લાયુનો સીમ વાડી વિસ્તાર
3	Uk sinis bis 11		सवारे ७.००थी	હેમલાઇ કૃષ્ટિનું, સોરઠીયા કૃષ્ટિનું , જ્યુબન પાર્ક, સ્વાસર નાકા , રોખ દીંબો , કુંભાર શોક , વાગડીયા શોક વગેરે
	१९ हेरी अंगाओर कार्राल (कांगर कोरे पेटा विकास)		લ્લોરે ૨.૦૦	નગરપાલિકા ઓફીસ સામે, દેવલિયા નાકા ,બાર મીટર રોક અભુબાયુનો વિસ્તાર અને ગંગાના કાવિસ્તાર વગેદે
×	१९ हेर्ड क्लेप्स्य इंन्डर्स्ट्रीयत (श्यापन वेटा विकास)		स्वरं ४.००वी स्वरं २.००	જવાલ્સનગર, મોડવદર તથા યુક્વનો એ ધોગીક વિસ્તાર.
	११ हेवी ओपाठ-स्टर्नेशका		સવારે	રઘાર ગામ અને ગામની આવુલાયુનો વિસ્તાર
	er de prima de la como de prima de prim		૯.০০খী	રપ્પર વોટર વર્કત એશ.ટી. કનેક્લન
ų	१९ केंग्री कारतिया क्षेत्र (कांकर आगा-श्वीराविध्यम)	(शक्तिवार) १४-०२-२४	coulà e.oo	ભીમાસર ગામની આયુધાયુનો વાડી વિસ્તાર
	11 del albuse èrgons	(EMAILE)		ભીમાસર ગામની આપુ-બાપુનો ઓદ્યોગીક વિસ્તાર.
ξ	१९ हेवी शमार्थीकी इर कोंग्रेस होने ११		સવારે	બીમસર ગમની આપુ-બાપુનો સોધોગીક વિસ્તાર.
	११ हेवी न्वेदीव क्षेत्र ही. क्षेत्रकंक		८.00ଥୀ	નોલેલ એય.ટી. કને ક્શન
	र्शक्तरांत . डि.कांक त्रोक्क किर्त ११		બપોરે	ભીષાસર ગામની આપુ-બાપુનો ઓધોગીક વિસ્તાર.
	૧૧ કેલીમેટ્રેડ લોગ તો. લોગલોલ		8.00	મેટ્રેડ અને ટીમિક એચ.ટી.કનેક્શન.
	Ariam man . Ari Co			l .

અલ્વજદારપોતાની ફરિયાદ માગારી ઇપનીના ટોર્ડ્સ નંબર (૧) ૧૮૦૦૨૩૩૧૫૫૩૩૩ (૨)૧૬૧૨૨ પર દર્જ કરાવી (જણાવી) શકે છે. ઉપરોદ્ધ કચેરીરેક્કાના તીજરાહકો માટે ભુજપત તે લાંકરત પ્રાહક લક્ષ્યર નિવારણ કેન્દ્રમાં રજૂઆત કરી શકે છે. કાર્યપાલક ઇજનેર, વિભાગીરા કરોરી, અંજાર

#### **WELSPUN ENTERPRISES LIMITED** Welspun ENTERPRISES

CIN: L45201GJ1994PLC023920

Regd. Office: Welspun City, Village Versamed, Taluka Anjar, Osbrict Kutch, Gujarat - 370110.

Corp. Office: Welspun House, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Parel (West), Mumbai - 400013.

Wobsite: www.wespunenterprises.com Email 1d : companysecretary, wel@wuspun.com

г			Quarter ende	d	Period	ended	Year ended
Sr. No.	PARTICULARS	31 Doc 2023	30 Sept 2023	31 Doc 2022	31 Dec 2023	31 Doc 2022	31 March, 2023
L		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
1	Total income	753.92	692.65	716.76	2,196.61	1,985.17	2.901,64
2	Net Profit for the period from continuing operations						275
	(before tax and exceptional items)	135.52	96.94	58.75	358.96	132.17	258,44
3	Exceptional items (net)			356.86		423.54	482.99
4	Net Profit for the Period from continuing operations						
	before tax (after exceptional items)	135.52	96.94	4 15.61	358.96	555.71	741.43
5	Net Profit for the period from continuing operations after tax	89.49	65.11	400.70	247.18	525.51	681.12
	(after exceptional items and excluding non-controlling						
	interests)						
6	Net Profit / (Loss) for the period from discontinuing						
	operations after lax	(17.94)	(3.08)		(21.82)	55.75	41.64
	(after exceptional items and excluding non-controlling interests)						
7	Net Profit for the period from continuing and discontinuing						
	operations after tax and after exceptional items and						
L.	excluding non-controlling interests	71.55	62.03	400.70	225.36	581.26	722.76
8	Total Comprehensive Income for the period from continuing				228.03		
	and discontinuing operations	71.28	65.22	400.72	228.03	580.37	719.63
	(Comprising profit for the period (after tax) and Other						
	Comprehensive Income (after tax) and excluding non-controlling interests						
9	Paid-up equity share capital (Face Value Rs. 10/- each)	136.41	136.41	149.98	136.41	149.98	149.98
	Reserves (excluding Revaluation Reserve)	130.41	130.41	149.98	130.41	149.90	2.206.03
11	Eamings per share (EPS) for continuing operations *						2.200.03
Г"	(a) Basic EPS (Rs)	6.55	4.78	26.75	17.98	35.04	45.42
	(b) Diluted EPS (Rs)	6.49	4.69	26.69	17.78	34.97	45.42
12	Earnings per share (EPS) for continuing and	0.49	4.05	20.05	17.76	34,51	45.51
l'^	discontinuing operations *						
	(a) Basic EPS	5.24	4.56	26.75	16.39	38.76	48.19
	(b) Diluted EPS	520	4.47	26.69	16.21	38.68	48.08
			20.00		-		
	Earnings per share not annualised for quarter and year to da		espector Dates	ea eamings pe	er snaze, the e	nects or awdin	nive potential
H	equity shares are adjusted except when the results would be	anti-oxitivo.					
IN.	dos:-						

105: The above is an extract of detailed format of quarterly and nine months ended financial results filed with the stock exchanges of the SEG (Listing Obligations and Disclosure Requirements) Regulation 2015. The full format of the quarterly and nine results are available on the Stock Exchanges wholse in-www.nsenida.com and wavebeindia.com and earlied and an accordance of the stock of the st

Place : Mumbai Date : 1 February 2024

			Quarter ende	d	Period	ended	Year ended	
Sr.		31 Dec 2023	30 Sept 2023	31 Dec 2022	31 Dec 2023	31 Dec 2022	31 March, 2023	
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)	
1	Total Income	606.83	571.05	680.16	1.887.33	1.89 1.36	2,775.01	
2	Nel profit for the period (before tax and exceptional items)		76.86	55.08	308.84	124.51	250.16	
3	Nel profit for the period before tax (after exceptional items)	111.94	76.86	522.88	308,84	597.57	760.06	
4	Not profit for the period after tax	77.58	53.77	510.92	220.99	575.49	713.12	
5	Total Comprehensive Income for the period (after tax)	77.30	56.96	510.92	223.65	574.59	710.06	

CMYK —



# મોદી સરકારનું સક્ષમ, સંતુલિત અને સ્વનિર્ભર બજેટ સાયબર ક્રાઈમથી બચવા બાબતે ભુજમાં વેપારીઓને અવગત કરાયા

ભુજ : ગુરૂવારે દેશની સંસદમાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને આ વર્ષના અંતરિમ અને મોદી સરકારના બીજા કાર્યકાળના અંતિમ બજેટને રજૂ કર્યું હાર્તું, કચ્છ જિલ્લાના નાશામંત્રીએ રજૂ કરેલા લેખાનુંદાનને મિશ્ર પ્રતિસાદ લેખાનુંદાનને મિશ્ર પ્રતિસાદ જનતા પાર્ટી અને વાકિજ્ય લેત્રમાં બજેટની જોગવાઈઓને આવકાદદાયક ગલાવવામાં આવી છે. જયારે વિચલી કોંગ્રસ આ બજેટમાં સગયક્ષ્ય જેવું કંઈ ન હોવાનું કહીને બજેટની આલોચના કરી છે. 500 જિલ્લા ભાજપ : સંગઠનના અખ્યક દેવજીભાઇ વર્ચદે આ બજેટને આ બજેટને તૃતન ભારતના નિર્માણના રજૂ કર્યું હતું. કચ્છ જિલ્લામાં નાણામંત્રીએ રજૂ કરેલા

નૂતન ખાસાગા દરવાક .. મજબુત પાયા સમાન લેખાવીને જશાવ્યું હતું કે, મોદીજીના ૨૦૪૭ના વિકસિત ભારતના નિયરિને આ બજેટ થકી ઔર રેઇઝરખા પિકાસત ખારતમાં નિપારિને આ ભજેટ શકી બોંદ મું બહેવાં કરાત થશે. રપ કરોડ લોકોન ગરીબીમાંથી કાઢવામાં આવ્યા અને ઉજ લાખ કરોડ જેટલી વિસાટ કરવામાં આવ્યા અને ઉજ લાખ કરોડ જેટલી વિસાટ કરવામાં આવી, આગામી સમયમાં 3 કરોડ જેટલી લખપ તિ દીદીનું પણ લલ્લમાં નિપારિત કરવામાં આવે છે. યુવાનો માટે 3 હજર નવી આઇઆઇટી ખોહવામાં આવી છે. પૂજ લાખ યુવાનોને તાલીમ પણ આપવામાં આવે છે. પીત્રેને મિક્સાન યોજના માટે ૧ , ૮ કરોડ લોકોને આર્થિક મદદ મળી રહી છે. આ જેટમાં વેંગીના સરકારિત કરવામાં અંગી છે. આ જેટમાં વેંગીના સરકારિત કરવામાં આવી છે. આ જેટમાં ત્રેની કરવામાં અંગીના સરકારિત કરવામાં સરકાર્યા છે. આ જેટમાં ત્રેનીના સરકારિત કરવા પર ભારૂ વર્ગના સરકારિત કરવામાં સરકાર કરવા પર ભારૂ વર્ગના સરકારિત કરવામાં સરકારિત કરવામાં સરકાર કરા કરવામાં સરકાર કરા કરવામાં સરકાર કરવામ વર્ગના સશકિતકરણ પર ભાર પુગના સતાકતકરશ પર ખાર મુકવામાં આવ્યો છે. સરવાળે આ બજેટથી પાવર સેક્ટર, બેંક સેક્ટર, ટુરિઝમ સેક્ટર અને ફિશરીઝ સેક્ટરને પણ ફાયદો

કચ્છમાં વચગાળાના બજેટ માટે મિશ્ર પ્રત્યાઘાત : વાશિયજ્ય સંસ્થાઓ અને ભાજપે બજેટને આવકાર્યુંઃ કોંગ્રેસે બજેટને ગણાવ્યું દિશાહિન

કોપ્રસ ખજે તે પે થશે. જિલ્લા ભાજપ અપલે આ જેટને સર્વલશી, સંતુલિત અને સર્વમાત્મ હોવાનું ગણાવ્યું હતું. પંક્ર જ મહેતા: આ જેટને પૂર્વ ધારાસભ્ય પંક્રજનાઈ મહેતાએ જેટને વધાવ્યું હતું. તેમણે જજાવ્યુ હતું કે, દેશના વિકાસને ખાને લઈ નાણામંત્રીએ લોકોની આક્રાલા પૃદ્ધું કરતી યોજનાઓ જાહેર કરી છે, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧ કરોડ મકાન બનાવવા, સૂર્યોદ્દ યોજના હેઠળ ૧ કરોડ ઘરોમાં સોલારથી વીજળી આપવાની અને ૩૦૦ યુનિટ સુધી ફ્રી વીજળી આપવા, સ્વાર્ડિયલ કેન્સર અંગેની રસી આપવા, આયુપ્રમાત ભારત સુધી કી વીજળી આપવા, સવર્ધિકલ કેન્સર એંગીન રસી. આપવા, આયુષ્યાન ભારત પોજનામાં વિસ્તૃતિકરણ, જિલ્લા છીઠ મેડિકલ કોલેજ ખોલવા, ૧૦ લાખ ખેડૂતોને નવી રોજગારી આપી કિશાનોને સશકત ખેડિક મેડિકલ કોલેજ ખોલવા, ૧૦ લાખ ખેડૂતોને પ્રોત્સાહન ઉપરાંત લક્ષકીપના વિકાસ માટે નવી પોજના શરૂ ચકે, ૩૦૦ નવી પોજના શરૂ ચકે, ૩૦૦ નવી પોજના શરૂ ચકે, ૩૦૦ જો પારતીએ ત્યારે પુક્ત ૧૦૦ જો પારતીએ ત્યારે પુક્ત ૧૦૦ જો પારતીએ ત્યારે પુક્ત ૧૦૦ જો પારતીએ ત્યારે પ્રસ્તુતી કરવામાં આવશે. ૨૫ હજાર સુધી કરવામાં આવશે. ૨૫ હજાર સુધી પારતીમાં જન્મ એક વર્ષ ૨૦૦૦ ના પુષી અને ૨૦૦૬ ના પુષી આવશે. ૨૫ હજાર ૧૫ મુંલીમાં જુના બાકી કરાશે. દેશને વિકસિત કરવા માટે કન્દીય ભજેટમાં આ મુદાઓને પ્રાપાન્ય આપી દેશને આત્મનાલીતા સાથે વિશ્વ ગુરૂ આત્મનાલીતા સાથે વિશ્વ ગુરૂ આત્મનાલીતા સાથે વિશ્વ ગુરૂ આત્મનાલીતા સાથે વિશ્વ ગુરૂ

ખનાવવાના હશ્યને આવનારા સમયમાં નવી ગતી મળશે તેવું કચ્છ કોંગ્રેસ : કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પજુરિનસિંહ જોજના જણાવ્યા અનુસાર હ્યારે વધુ એક ભજેટ રજુ કરી હોંગ્રેમે નિરાશ કર્યા છે, પ્રજાને ખૂબ જ આશા હતી કે મોંઘવારીને કાલ્યુમાં લેવા નક્કર આયોજન હશે, પરંતુ સરકરાની દ્રષ્ટિ દેશના આર્થિક દિશક્ષ માટે નહીં, પરંતુ પ્રજાને ખુસ્યુસ્ટ કરવાની કહે, મધી મંદી માટે મહિ દેશના આર્થિક વિકાસ માટે નહીં, પરંતુ પ્રજને ગમુરાહ કરવાની છે. સામાન્ય રીતે આજનું બજેટ આંકડાની માયાજાળ સિવાય કંઈ જ નથી. આપ્યમાં કંઈ જ રાહત નથી. મધ્યમવર્ગ પાયમાલ છે. પ્રજા સુવિધા સંપન્ન બની રહે તેવા રામરાજયની કંઈ જ જોગવાઈ કરાઈ નથી, જેથી કોંગ્રેમ પાસ આ બજેટને વખોર છે. ઉપરાંત આગેવાનો દિયક ડાંગર, પાસી. ગઢવી, યન્યચામસિંહ ભાટી, ગનીભાઈ કુંભાર, રામદેવસિંહ જોડળ, કિશોરદાન ગઢવી, યીરજ ગરવા વગેરેએ આ બજેટને વખોરાલું હતું.

હતું. **કરછ રોમ્બર** : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરાયેલા બજેટને કચ્છ ચેમ્બરે આવકાર્યો છે. આ કચ્છ ચમ્બર આવકાયા છ. આ બજેટમાં ખાસ કરીને રાષ્ટ્રના વિકાસને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવાની નેમ વ્યક્ત કરાઈ છે. સામાન્ય જન - મધ્યમવર્ગની આવક પરના ઈન્કમટેક્ષના સ્લેબમાં રાહતોની રાહ જોવાતી

હતી એમાં નિરાશા સાંપડી છે, પણ અન્ય વિકાસતા પ્રકલ્યો અને રાષ્ટ્રની આર્થિક ઉત્તરિ પર લોકોનો વિશ્વાસ છે. બજેટમાં ખાસ કડીને રાષ્ટ્રના યુવાધન, મહિલાઓ અને ખેડૂત વળે દરેકની આર્થિક ઉત્તરિ મોટે ખાસ પ્રાવધાન કડાયું, જે આવકાર્ય છે. પી.એમ. આવાસ યોજના અને લાંધકામ શેરને અપાયેલ પ્રોત્સાહનાથી રોજ્ડપારીને

ગતાં વનાકાન પત્રને જેવાવનું પ્રોજાવાદની પોજાવાદની ખાલ વેગ મળશે. આવાના દિક્સોમાં સરકાર દ્વારા વધુ પેડિકલ કોલેજની મંજુરીને કરુક વેખરે આવકાર્યો છે. નાલામાંત્રીએ કરવેરામાં, આવાત જૂટી સહિત પ્રત્યા અને પરોક કરવેરામાં સમાનદરો જળવી રાખેલ છે, જે રાષ્ટ્રની આર્થિક ઉત્તરીને માટે ખૂબ જ ઉપયોગી નિવારો. એમએએએમેઈ માટે વધુ પ્રોત્સાકાનને કરૂગ વેમ્બરમાં સમાનદરો જાળવી પત્રના પ્રત્યુ અલે છે. જે રાષ્ટ્રને આર્થિક કોમને એક ઇન્ડરફીઝ ફેડેશન બુજ કે કેર્યું અલે અલકાર્યો છે. પ્રત્યું કર્યું કર્ય

પ્રોત્સાહન જેવી અનેક જોગવાઈઓ આવકારદાયક છે.

પશ્ચિમ કચ્છ પોલીસ દ્રારા જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો. હવે તાલુકાકક્ષાએ પણ સેમિનાર યોજી જાહેર જનતાને સાવચેતીના પગલા ભરવા બાબતે સમજ અપાશે

ભુજ : પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ભજમાં પોલીસ ભવન ખાતે દ્ધારા ભુજમાં પાલીસ ભવન ખાત સાયબર કાઈમ, ધંધા-રોજગાર તેમજ ઓનલાઈન દગાઈ સહિતના ગુનાઓથી બચવા જીહેર જનતાએ રાખવાનો થતા સાવચેતીના પગલાં ભરવા બાબતે અવેરનસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

નાજપામાં આવ્યા હતો. કાર્યક્રમમાં સાયબર સેલ દારા સાયબર ક્રાઈમ બાબતે જરૂરી સુચના અને માર્ગદર્શન પ્રેઝન્ટેશનના માધ્યમથી પ્રેઝેન્ટેશર્મના માધ્યમથી આપવામાં આવ્યું હતું. સાયબર કાઈમ કોને કહેવાય, કારણો, પ્રકારો, સોશિયલ મીડિયાથી થતા કોડ, નાણાકીય ઠગાઈ, નો કરી માટે છેતરપીડી, ન્યુડ વીડિયો કોલ કરીને હનીટ્રેપમાં કસાવાનો પ્રયાસ, તાલકાલિક લોન આપવાના નાય રસાંસા પ્રવાસ, તાંગાલક લોન આપવાના નામે છેતરપીંડી, બનાવટી લીંક, બનાવટી કોલ, ઓનલાઈન વસ્તુ વેચાણ માટે પ્લેટફોર્મ બનાવી છેતરપીંડી, સ્ક્રીન સેરીંગ એપ કે રિમોટ એક્સેસ સરાળ અપ કારનાટ અઝસસ એપ દ્વારા ફોડ, કસ્ટમર કેર ફોડ, ઓએલએક્સના નામે ઠગાઈ સહિતના બનાવોની અદાણી પોર્ટસની વધુ એક સિદ્ધિ



સાર્ય કરાવાના કાર્યા હતા. આ ઉપરાંત તેનાથી બચવા શું કરવું તે અંગે વાકેફ કરાયા હતા. ચાઈલ્ડ પોર્નોગ્રાફી તેમજ સોના-ચાંદીના વેપાર, આંગણીયા વેપાર, પેટ્રોલ પમ્પ, ટ્રાન્સપોર્ટ વ્યવસાયમાં હતા. ચાઈલ્ડ પોર્નોગ્રાફી બાબતે સાયબર કાયદા વિશે પત્પ, દ્રાપ્સવાટ અવસાવના રાખવાના થતા સલામતીના પગલા બાબતે વેપારીઓને સૂચનો કર્યા હતા.ભુજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અનિલ ગોરે હાલમાં ટેકનોલોજી અને ડિજીટલ માધ્યમોની સમજ આપી સોશિયલ મીડિયા સિક્યુરીટી અંગે રાખવાના થતા જરૂરી સાવચેતીના પગલાં અને સાયબર ક્રાઈમ હેલ્પ લાઈન નં.૧૯૩૦ વિશે જરૂરી વાઇન ના હિંહુઇ વિસ જફરા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત એસપી મહેન્દ્ર બગડિયાએ મદદ લઈ બનતા સાયબર અને ઓનલાઈન ગુનાઓને લાલબતી સમાન લેખાવી લોક જાગૃતિ આવે તો જ ગુના રોકી અસમાં મહન્દ્ર બગાડવાએ જણાવ્યું કે, સાયબર ક્રાઈમના મુખ્ય કારજ્ઞો ડર, લાલર અને આળસ છે જે લોકો જાગૃત થાય અને આવા ગુના બને ત્યારે ડર, લાલચ અને આળસ્ જાગૃત આપ તો જ ગુના રાકો શકાશે તેવું જણાવ્યું હતું. સેમિનારના અંતમાં પ્રશ્નોત્તરી દરમિયાન ભુજના વકીલ સંદીપ શાહે રજૂઆત કરી ત્યાર ડર, લાલચ અન આખસ છોડીને આગળ આવે તો સ્માર્ટ પોલીસ ગુના અટકાવવામાં મદદરૂપ થશે. ગુનાઓને રોકવા માટે પ્રજા અને વેપારીઓ જાગૃ કે, ઘણી વખત એ બનાવો બને છે જેમાં ફરિયાદ લખાવવા માટે પરિવાર સંકોચ અનુભવે છે ત્યારે પારપારસકાય અંગુખનઇ ભ્યાર એસપીએ જણાવ્યું કે, આવી ઘટનાઓમાં મારો સંપર્ક કરવો અને કરિયાદીના નામ સહિતની વિગતો ગુપ્ત રાખવામાં આવશે અને પરિણામલક્ષી કાર્યવાહી કરી ભોગ બનનારને ન્યાય અપાવામાં આવશે. ત બને તે જરૂરિયાત હોવાનું ઉમેર્યું હતું. એ-ડિવિઝન પીઆઈ આર.આઈ.સોલંકી દ્વારા હાલમાં વિવિધ પ્રકારની

કાર્યક્રમમાં રીવાયએસપી ડાવાયઅસમાં આર.ડા. જાડેજા, એ.આર.ઝણકાટ, પ્રો. ડીવાયએસપી પાર્થ ચોવટીયા, એલસીબી પી્આઈ એસ.એન.્ અલસાબા પાંચાઇ અસ અન. યૂડાસમા, એસઓજી પીંચાઈ વી.વી.ભોલા, એલઆઈબી પીંચાઈ પી.બી.ગઢવી, રીડર પીંએસઆઈ આર.સી.ગોહિલ તેમજ ભુજ ચેમ્બરના સેક્રેટરી જગદીશભાઈ ઝવેરી, હુરીભાઈ ગોર, કચ્છ બુલિયન ફેડરેશનના પ્રમુખ જગદીશભાઈ ઠક્કર. ભુજ બુલિયન મર્ચન્ટ એસો.ના પ્રમુખ ભદ્રેશભાઈ દોશી, માંડવી ચેમ્બરના પ્રમુખ વાડીલાલભાઈ ચમ્બરના પ્રમુખ પાડાવાડવના દેશી, નાખત્રાજ્ઞા ચેમ્બરના પ્રમુખ રાજુભાઈ પલકુ નલિયા ચેમ્બરના પ્રમુખ હંકુભા જાડેજા, મેટલ મર્ચન્ટ અંકો ના પ્રમુખ અત્યમ બારમેડા, મૃન્દ્રા પ્રમુખ સત્યમ બારમેડા, મુન્દ્રા સોના–ચાંદી વેપારી એસો. ના પ્રમુખ રાજુભાઈ સોની, ભુજ ફૂટવેર મર્ચન્ટ એસો.ના પ્રમુખ જગદીશભાઈ ઠક્કર, ટ્રાવેલ્સ એસો.ના પ્રમુખ બાલકૃષ્ણ ઠક્કર સહિતના હાજર રહ્યા હતા.

# કંપની સામે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા કિસાન સંઘ આકરાપાણીએ

જિલ્લા સમાહર્તાને આવેદન પત્ર અપાયંઃ આવનારા દિવસોમાં જલદ આંદોલન કરશે : કિસાન સંઘ

ભુજ : કચ્છ જિલ્લા કિસાન સંઘ દ્વારા ક્લેક્ટર કચેરીની બાજુમાં ૨૫ જાન્યુઆરીથી ધરણા ઉપર બેસયા છે તેમ છતાં એચપીસીએલ કંપની હારા પુરતુ વળતર અપાયું નથી અને આ બાબતનું નિરાકરણ અને આ બોબતનું નિરાકરળ નહીં લાવવામાં આવે તો જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. તેમજ દુષઈ કેનાલ સબ બ્રાન્ચનો મુદ્દો અટકેલો છે તે પૂરો કરવા વગેરે માંગણીઓ સાથે કચ્છ કિસાન સંઘ ધરણા હજુ

પણ ચાલુ છે. આ અંગે કિસાન સંઘના ઓ અંગ દક્ક્ષાન સવના પ્રમુખ શિવજીભાઈ બરાડિયાએ જણાવ્યું છે કે, અગાઉ તંત્રને વળતર મુદ્દે ચાર પુરાવા અપાયા છે. તેમાં વળતર વધારે અપાયું છે અને જે ખેડૂતને વધુ નુકશાન થયું છે. ત્યાં વળતર ઓછુ ચુકવવામાં આવ્યું છે, જેથી તેની તપાસ



કરાવવામાં આવે અને તેમને પુરતું વળતર ચુકવવામાં આવે તેવી માંગ કરાઈ છે.

તેવી માંગ કરાઈ છે. સ્પ્રેગ્સ માંગ કરાઈ છે. સ્પ્રેગ્સમાં સુગારીયા ગામે કોઈપણ નોટીસ વગર ખેતારોમાં પાક, બાગાયતને નુકશાન કરાયું છે તેનું પંચનામું થવું જોઈએ. કંપની આબાતે કહ્યું કે ઈપની અને સરકાર એવું કહે છે કે આ તો જાહેરહીતનું છે એમાં કોઈ વળતર નહી છ અના કાઇ વળતર નહા મળે. જયારે કિસાન સંઘ તરફી કહેવામાં આવે છે કે સમાજ ઉથ્થાન માટે શિક્ષણ માટે તંત્ર જમીનની માંગણી કરે છે ત્યારે તેની કિંમત બજાર ભાવથી પણ વધુ અપાય છે. તેનો પુરાવો રજૂ કરીશું એ જાહેરહિતનું નથી

બાબતે ખેડૂતોના હિતમાં નુકશાન થયેલ તેનું વળતર ચુકવવામાં આવે તેવી માંગ કરી છે. આટલા દિવસથી ધરણા ઉપર બેઠા છીએ ાદપસથા પરક્ષા ઉપર ખઠા છાએ કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી નથી તેવું સ્પષ્ટ થાય છે. આગામી દિવસોમાં કાર્યવાહી નહી થાય તો આવનારા દિવસોમાં વિવિધ કાર્યક્રમો કિસાન સંઘ આપશે તેની જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

મુંદરા : દેશના અગ્રગલ્ય ખાનગી બંદર અદાશી પાર્ટસ અન્ એસઈંગ્રેડ (સ્પેશિયલ ઇકોનોમિક ઝોનોએ ઓર્ટરીબર્ચી દિસંખ્ય સુધીના વિચાસિક અને વર્ષ સ્ટર-૩ના છેલ્લા નવ મહિનાનાં તેનાં પરિશામી જાહેર કર્યાં હતા, જેમાં અદાશી જુશના પ્રથમ બંદર, મુંદરાએ જે વર્ષે કામગીરીનાં ૨૫ વર્ષ પૂરાં કર્યાં ત્યારથી પોર્ટ ફેબ્રુઆરીમાં ભચાઉ તેવો તંત્ર સામે સવાલ કરવામાં અને રાપર ખાતે તવા તત્ર સામ સવાલ કરવામાં આવે છે.ભારત ખેતી પ્રધાન દેશ છે તેમાં ખેડૂતોને જંત્રીનો ભાવ પ્રમાણે ખેડૂતોને કેમ જમીન અપાતી નથી ? દાડમના પાક વિશે કોરેસ્ટનો આંકડાકીય માહિતી અપી છે. તેના ખર્ચ वाहनोनो ङिटनेस

રીન્યુ કેમ્પ યોજારો ભુજ : કચ્છ જિલ્લાની મોટરીંગ પલ્લિક અને વાહન માલિકો માટે કેબ્રુઆરી માસમાં વાહનોની ફિટનેસ રીન્યુ કરાવવા અંગેનો કેમ્પ સવારે ૧૧ થી ર અગના કમ્ય સવાર ૧૧ થી ૨ કલાક સુધી તા.૭/૨ના ભચાલ, તા.૨૧/૨ના ૨૫૫૨ ખાતે યોજાશે. જેમાં તમામ પ્રકારના વાહનોનું ફિટનેસ રીન્યુ કરી આપવાની કામગીરી કરાશે તથા એઆરટીઓ અંજાર કચેરીએ પણ આ કામગીરી કરી અપાશે તેવું સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી અંજાર -કચ્છની યાદીમાં જણાવાયું છે.

#### પોર્ટ્સ અને સ્પેશ્યલ ઈકોનોમી ઝોનના કર બાદના નકામાં દપ ટકાનો નોંધપાત્ર વધારો

કવાર્ટર 3 અને નવ માસમાં સૌથી વધુ આવક, એબીકા અને કાર્ગો વોલ્યુમ સાથે તેનું અત્યાર સુધીનું સૌથી મજબૂત પ્રદર્શન હાંસલ કર્યું છે. અદાણી પોર્ટ અને એસઈઝેડ સંપૂર્ણ વર્ષ માટે પૂરાં પાડવામાં આવેલાં માર્ગદર્શનનું અનુસ્પ સિદ્ધ કરવા માટેના માર્ગ પર છે. વર્ષની શરુઆતથી આ પ્રદર્શન વર્ષની શરુઆતથી આ પ્રદર્શન ઓપરાટિંગ કાર્યક્ષમતા વધારવા અને ઉદ્યોગના અગ્રહ્યી પોર્ટ ઓપરેટટ રહેવાના અમારા સતત પ્રયાસોનો પુરાવો છે તેવું અદાણી પોર્ટ એન્ડ એસઈઝેડના સીઈઓ અશ્વિની ગુપ્તાએ જણાવ્યું હતું.

### ાા શતમ્ જીવમ્ શરદમ્ ॥ આપશ્રીના પુજમા જન્મ દિવસ નિમિત્તે શુભેચ્છા સાથે અભિનંદન <mark>પાદ</mark>વી<mark>એ છીએ. નિરોગી અને</mark> દીર્ઘાયુ આયુષ્યની અભ્યર્થના સાથે

જનહિતાના વધુને વધુ કાર્યો આપના જીવન દરસ્યાન થતાં રહેની આજના દિવસે પરમ શક્તિ પાસે પ્રાર્થના તથા મા આશાપુરાના આર્થીર્વાદ આપના પર સતત વરસતા રહોની જન્મદિવસની શભેચ્છા.

भा. श्री पीरेन्द्रसिंह शडेश ધારાસભ્યની, રાપર વિધાનસભા - પૂર્વ ધારાસભ્યન્ની, મુંદરા-માંડવી પ્રમુખલી, કચ્છ જિલ્લા રજપૂત રાત્રિય સભા

અમો લીએ આપના જ શલસિંતક

મુંદરા તાલુકા પંચાયત) • મયૂરસિંદ જગુભા જાંકેજા

મોડસ ઓપરેન્ડીથી સાયબર સિવાયના પણ ગુનાઓ બને

• રધુવીરસિંદ ધીરૂભા માર્કેમાં (રારાયાર્થી, ટપપર) • સ્ટ્રીચ-સિંદ મુનાવર્ધિક માર્કેમ (સામાવિક અત્રાણીશ્રી, ટપપર) (સામાવિક અત્રાણીશ્રી, ટપપર) (આજ ઉપસરપંચશ્રી, ટપપર)

## કચ્છમાં ઝાકળ વર્ષાથી ખેડૂતોને જીરાના પાકમાં કરોડોના નુકશાનની બીતિ

પાર્કમાં કરોડીના નુકશાનની ભીતિ પુષ્ક કરવામાં હાલ (૧૫૫ હાલામની પરિસિધ વર્ગ વહેલી લાઇ પુષ્ક કરવામાં હાલ (૧૫૫ હાલામની પરિસિધ વર્ગ વહેલી લાઇ પુષ્કમને આપણ ત્યારે વર્શ છે. કરવા તેમને પાર્ટલ હાર્વ કરે કરે કરવા કરિસાની અલગ ઉપ તેમ છે. સાર તેમ પાર્ટલ અથવા તેમને પાર્ટલ અથવા તાના રસ્તે કરાયો છે. ત્યારે કરાયો હારમાં અલગ ઉપ તેમ માર્ચન કર્યા તેમને પાર્ટલ અથવાની ભીતિ તેનું લક્ત કરી કરાયે છે. ત્યારા નાર્ટમ પાર્ટલ ક્યારલ થયાની ભીતિ તેનું લક્ત કરી કરાયે છે. ત્યારા નાર્ટમ પાર્ટલ ક્યારલ થયાની ભીતિ તેનું લક્ત કરી કરાયે છે. તેમાં ભારત પાર્ટલ સ્થારલ પોતાની લાકત લાંક માર્ટલમાં ભીનાથ કરી રહી છે. તો સવાર બાદ સુપદિત પોતાની લાકત ભારતના હોય એમ અરમી વધારી રસાયું જાલા મળ્યું હતું. વારના રાયક વર્ષા, માર્ટલમાં અમર કરાય કરાય પાર્ટલમાં પાર્ટલ કરવામાં આવે છે. તેમાં કરાયે કરાયો કરાયો કરાયો કરાયો હતા. કરવામાં આવે છે. તમારે સ્થારલ વર્ષોઓ જારાના પાર્ટમ પાર્ટફ કરામન ગાલવામાં તમે છે. તેના કરાયે આકરના પાર્ટલ કરાયના પાર્ટન કરાયો પાર્ટલ પાર્ટલ કરાયો આવે છે. તેમાં કરાયે લાયો અપ્યાર્ટની કરાયો કરાયો હતા. છે. તેમના કરાયે લાયો કરતા વારના પાર્ટલ કરાયના પાર્ટન કરાયો માત્ર હતા માત્રના કરાયે અપ્રતાનો અપ્રતાનો અપ્રતાનો સાર કરાયો કરાયો કરાયો હતા કરાયો છે. તેના કરાયો કરાયો કરાયો કરાયે કરાયો હતા પાર્ટલ હાર્મિ હાર્યા માત્રના કરાયો કરાયો કરાયો કરાયો કરાયે કરાયો પાર્ટલ હાર્યા કરાયો કરાયો કરાયો કરાયો કરાયો કરાયો હતા દરે હાર્યા કરાયો હતા કરાયો કરાયો કરાયો કરાયો કરાયો કરાયો કરાયો હતા દર હાર્યા કરાયો હતાને કરાયો હતા કરાયો કરાયો કરાયો કરાયો કરાયો કરાયો કરાયો હતા દર હાર કરાયો હતા કરાયો કરાયો કરાયો કરાયો કરાયો કરાયો કરાયો હતો. કરાયા કરાયો કરાયા કરાયા કરાયો કરા





_	The state of the s	0.000						
એ.	બિડ ડોક્યુમેન્ટ ડાઉ <mark>નલોડ</mark> કરવાની છેલ્લી તારીખ	ता. १५/०२/२०२४ ११:०० स्थार सुपी						
બીક્ર	ઓનલાઈન સબમિ <mark>શનની</mark> છેલ્લી તારીખ	તા.૧૫/૦૨/૨૦૨૪, ૧૮:૦૦ કલાક સુધી						
સી	દસ્તાવેજના બોતિક સબમિશન માટેની છેલ્લી તા <mark>રીખ</mark>	તા.૧૯/૦૨/૨૦૨૪ થી તા.૨૨/૦૨/૨૦૨૪ ૧૮:૦૦ કલાક સુધી (કચેરી સમય દરમ્યાન) ઉપરોક્ત કામનું ભરેલ ટેન્ડર ફક્ત રજી, પોસ્ટ એ.ડી.સ્પીડ પોસ્ટ/ કુરીયરથી કચેરીમાં રજુ કરવાના રહેશ						
a	સંપર્ક કચેરી	કાવેપાલક ઈજનેરહ્યીની કચેરી, કચ્છ સિંચાઈ વિભાગ, પવનચક્કી કમ્પાઉન્ડ, કેમ્પ એરિયા, ભુજ-કચ્છ. પીન નં. ૩૭૦૦૦૧, કોન નં. (૦૨૮૩૨) ૨૨૦૪૦૭ EMAIL: eckidbhj@gmail.com						
Ó	ત્રી-બિડ મિટીંગ	DIL W P R						
એ.5	ઓનલાઈન ઓપનિંગની તારીખ (પ્રિલીમીનરી સ્ટેજ)	તા.૧૫/૦૨/૨૦૨૪ના ૧૮,૦૫ કલાકે કાર્યપાલક ઈજનેરશ્રીની કચેરી, કચ્છ સિંચાઈ						

વિભાગ, ભુજ-કચ્છ

વ'ધુ વિગતો અને બિડ ઓનલાઈન સબમિશન માટે કૃષા કરીને વેબસાઈટ www.tender.nprocure.comની મુલાકાત લો. (નામાનિકચ્છ-૧૦૨૨-૨૦૨૩/૨૪)

#### **WELSPUN ENTERPRISES LIMITED** Welspun ENTERPRISES

CIN: L45201GJ1994PLC023920

Regd. Office: Welspun City, Village Versamedi, Taluka Anjar, District Kutch, Gujarat - 370110.

Corp: Office: Welspun House; Kannda Mills Compound, Senapei Bejard Merg; Lower Paral (West), Mumbai - 400013.

Website: www.welspunenterprises.com Email Id: companyscorelary\_wel@welspun.com

Extract of Statement of Unaudited Consolidated Financial Results

						(Rupee	s in Crores	
		Quarter ended			Period ended		Year ended	
ć O	PARTICULARS	31 Dec 2023	30 Sept 2023	31 Dec 2022	31 Dec 2023	31 Dec 2022	31 March 2023	
-		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)	
П	Total income	753.92	692,65	716.76	2,196.61	1,985,17	2,901.64	
	Net Profit for the period from continuing operations			- /				
	(before tax and exceptional items)	135,52	96,94	58,75	358,96	132,17	258,44	
ı	Exceptional items (net)		- 8	356.86	-	423.54	482.99	
	Net Profit for the period from continuing operations			/				
	before tax (after exceptional items)	135,52	96,94	415,61	358,96	555,71	741,43	
ı	Net Profit for the period from continuing operations after tax	89.49	65,11	400.70	247,18	525.51	681.13	
ı	(after exceptional items and excluding non-controlling			4				
	Interests)			-				
ı	Net Profit / (Loss) for the period from discontinuing							
	operations after tax	(17,94)	(3.08)	-	(21.82)	55.75	41.6	
	(after exceptional items and excluding non-controlling interests)							
	Net Profit for the period from continuing and discontinuing							
	operations after tax and after exceptional items and							
	excluding non-controlling interests	71.55	62.03	400.70	225.36	581.26	722.7	
	Total Comprehensive Income for the period from continuing							
	and discontinuing operations	71.28	65.22	400.72	228.03	580.37	719.6	
	(Comprising profit for the period (after tax) and Other							
	Comprehensive Income (after tax) and excluding							
	non-controlling interests							
ı	Paid-up equity share capital (Face Value Rs. 10/- each)	136,41	136,41	149,98	136,41	149,98	149,9	
ı	Reserves (excluding Revaluation Reserve)						2,206.0	
	Earnings per share (EPS) for continuing operations *							
	(a) Basic EPS (Rs)	6,55	4.78	26.75	17.98	35.04	45.4	
	(b) Diluted EPS (Rs)	6.49	4.69	26.69	17,78	34,97	45,3	
	Earnings per share (EPS) for continuing and				V V			
	discontinuing operations *	1.0		1/2				
	(a) Basic EPS	5.24	4.56	26.75	16.39	38.76	48.1	
	(b) Diluted EPS	5.20	4.47	26.69	16.21	38.68	48.0	

Rupees in Crores									
			Quarter ende	d	Period ended		Year ended		
Sr. No.		31 Dec 2023	30 Sept 2023	31 Dec 2022	31 Dec 2023	31 Dec 2022	31 March, 2023		
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)		
1.	Total Income	606.83	571.05	680.16	1,887,33	1,891.36	2,775.01		
2	Net profit for the period (before tax and exceptional items)	111.94	76.86	55.08	308.84	124.51	250.16		
3	Net profit for the period before tax (after exceptional items)	111.94	76.86	522.88	308.84	597.57	760.06		
4	Net profit for the period after tax	77,58	53,77	510,92	220,99	575,49	713,12		
5	Total Comprehensive Income for the period (after tax)	77.30	56.96	510.92	223,65	574.59	710.06		
For Welspun Enterprises Limited									